

B.A. Semester - 4 (CBCS) Examination
March/April-2023 [OLD COURSE]

ECONOMICS: P9 ECONOMICS OF PUBLIC FINANCE - 2(ELECTIVE-2)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ જાહેર અર્થવિધાનનો અર્થ આપી, તેનું સ્વરૂપ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત તેની મર્યાદા સાથે સમજાવો.
- પ્રશ્ન.૨ જાહેર આવકનો અર્થ આપી, તેના વિવિધ સ્ત્રોતો સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ જાહેર ખર્ચની અર્થતંત્ર પરની અસરોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૩ જાહેર ખર્ચ એટલે શું? જાહેર ખર્ચ વધવાના કારણો સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ જાહેર ખર્ચનું વર્ગીકરણ સમજાવો.
- પ્રશ્ન.૪ કરદાન ક્ષમતા એટલે શું? નિરપેક્ષ કરદાન ક્ષમતા અને સાપેક્ષ કરદાન ક્ષમતા વિગતે સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ ઉત્તમ કર પદ્ધતિના લક્ષણોની વિગતે ચર્ચા કરો.
- પ્રશ્ન.૫ ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
1. કરદાન ક્ષમતાને અસર કરતા પરીબળો
 2. જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર
 3. કરવિવર્તન અને કર સંપાતનો ખ્યાલ
 4. જાહેર જમા ખર્ચ અને ખાનગી જમા ખર્ચ

ENGLISH VERSION

- Q.1** Give the meaning of public finance and explain its nature. (14)
OR
- Q.1** Explain the theory of maximum social welfare with its limitation.
- Q.2** Give the meaning of public revenue and explain the source of public revenue. (14)
OR
- Q.2** Discuss the effects of public expenditure on economy.
- Q.3** Give the meaning of public expenditure and explain causes of rising public expenditure. (14)
OR
- Q.3** Explain the classification of public expenditure.
- Q.4** What is taxable capacity? Explain in brief the absolute taxable capacity and relative taxable capacity. (14)
OR
- Q.4** Discuss the characteristics of best tax system in brief.
- Q.5** **Write short notes. (Any Two)** (14)
1. Factors affecting taxable capacity.
 2. Scope of Public finance
 3. Concept of shifting of taxation and incidence of taxation
 4. Public finance and private finance